



છાણીયુખાતર: આશરે હેક્ટરિંદ્ર ૨૦ ટન આપવું.

વોટર સોલ્યુબલ: રાસાયણિક ખાતર ફોન્ડોન્ડોન ના.ફો.પો./છોડ ફર્ટિગેશન પ્રારા ૧૦ દિવસના અંતરે (એપ્રિલ થી મે તથા ઓક્ટોબર થી નવેમ્બર) સરખા હપ્તામાં આપવું જોઈએ એટલે કે ફોન્ડોન્ડોન ગ્રામ ના.ફો.પો./છોડ પ્રતિ એક હપ્તામાં આપવું પડે.

### છાણીયુખ

સારી ગુણવત્તા વાળા ફૂલ મેળવવા છાણણી અગત્યની બાબત છે. પદ્ધતિસર છાણણી કરેલ છોડની ડાળીઓ સમતોલ પણ ગોડવાયેલ દેખાય છે તેમાંથી નીકળતી ડાળીઓમાં સારી ગુણવત્તા વાળા મોટા ફૂલો બેસે છે. ગુજરાત રાજ્ય માટે ઓક્ટોબર માસનું બીજું અઠવાડીયુખ છાણણી માટે વધુ અનુકૂળ છે.

### કુલ ઉતારવા

કુલો વહેલી સવારે અથવા મોડી સાજે સાધારણ ખીલવાની તૈયારી વાળા ઉતારવા જોઈએ.

### ઉત્પાદન

આધુનિક ખેતી પદ્ધતિથી હેક્ટરે લગભગ ૫ થી ૬ લાખ જેટલા કુલોનું ઉત્પાદન થાય છે.

### પાક સંરક્ષણ

કૃષિ યુનિવર્સિટી તથા કૃષિ સાથે સંકળાયેલ સંસ્થાઓની વખતો વખતની ભલામણ મુજબ સંરક્ષણ ના પગલા ભરવા જરૂરી છે.

### અર્થકરણ

ટપક પદ્ધતિનો વાર્ષિક ખર્ચ (રૂ./હે.) –	૧૫,૦૦૦/-
આવરણ (કાળું પ્લાસ્ટિક) ખર્ચ (રૂ./હે.) –	૩૦,૦૦૦/-
ખેતી ખર્ચ (રૂ./હે.) –	૧,૫૫,૦૦૦/-
કુલ ખર્ચ (રૂ./હે.) –	૨,૦૦,૦૦૦/-
કુલ આવક (રૂ./હે.) –	૪,૫૦,૦૦૦/-
ચોખ્યી આવક (રૂ./હે.) –	૨,૫૦,૦૦૦/-

## ગુલાબની આધુનિક ખેતીમાં ખાતર તથા પિયત વ્યવસ્થાપન



### સંક્લન

ઇજ. બી.એમ. સોલીયા, ઇજ. એન.જી. સવાણી, ડો. સી.એસ. દેસાઈ, ડો.એસ.એલ. પવાર,  
ડો. જે.એમ. પટેલ, ડો.વી.આર. નાયક, શ્રી. આર.બી. પટેલ અને ડો. વી.પી. ઉસદરીયા

### જળ અને જભીન વ્યવસ્થાપન સંશોધન ચુનિટ

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી  
વર્ષ : ૨૦૧૫-૧૬

ગુલાબ એ ગ્રીક માન્યતા મુજબ પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે. ગુલાબ એ આજે વિશ્વમાં પ્રથમ નંબરનું લોકપ્રિય ફુલ છે. છેલ્લા દાયકાથી દિન પ્રતિદિન ફુલોની ખેતીનું મહત્વ તેમજ ઉત્પાદન વધતું રહ્યું છે.

ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ તેમજ ડાંગ જીલ્લાઓમાં આશરે ૧૮૫૦ હેક્ટર વિસ્તારમાં ગુલાબની ખેતી થાય છે. ગુલાબના ફૂલોમાથી ગુલાબ જળ, ગુલંગ અને વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ પણ બને છે.

### ગુલાબની જાતો:-

#### ૧. હાઈબ્રિડ ટી

- (અ) વિદેશી જાતો:- અમેરીકન, ડચ, ગ્લેડીયેટર, પેરેડાઇઝ, બ્લુમુન વગેરે  
(બ) ભારતીય જાતો:- સુગંધા, અર્જુન, રક્તગંધા વગેરે

#### ૨. ફુલોરીબન્ડા

#### ૩. પોલીઅન્થા ગુલાબ

#### ૪. વામન (મિનિયેચર) ગુલાબ

#### ૫. વેલીઆ ગુલાબ

### જમીનની તૈયારી

સારી નીતાર વાળી મધ્યમ કાળી ફળદુપ ગોરાળું જમીન ગુલાબની ખેતી માટે વધુ અનુકૂળ આવે છે. ગુલાબના વાવેતરની જમીનને સૂર્યપ્રકાશ માં ૧૫ થી ૨૦ દિવસ સુધી તપાવવી અથવાતો જંતુ, નીદણ કે ફૂલીવાળો વિસ્તાર હોય તો તેનો સોઈલ સોલરાઈઝેશન દ્વારા નાશ કરવો. ગુલાબને વધુ સૂર્યપ્રકાશ મળી રહે એવી જગ્યા પસંદ કરવી જોઈએ. ગુલાબનું વાવેતર બે લાઈન વચ્ચે ૧૦૦ સે.મી., બે છોડ વચ્ચે ૧૦૦ સે.મી. અંતર તથા જોડીયા હાર વચ્ચે ૨૦૦ સે.મી. અંતર રાખી રોપણીની જગ્યાએ ત૦ સે.મી. ના ખાડા ખોદી જમીનને ખુબ તપવા દેવી જરૂરી છે. ત્યાર બાદ જરૂરી સેન્ટ્રીય ખાતર નાખી ખાડા પુરી દેવા જોઈએ.

### સંવર્ધન

દેશી ગુલાબનું સંવર્ધન કટક કલમ અથવા ગુટીકલમથી કરવામાં આવે છે. જ્યારે હાઈબ્રિડ ગુલાબનું સંવર્ધન આંખ કલમ થી કરવામાં આવે છે.

### ફેર રોપણી

ગુલાબનું જોડીયા હાર પદ્ધતિમાં વાવેતર કરવા માટે મુખ્યત્વે હાલમાં ગ્લેડીયેટર

ગુલાબનો વિસ્તાર દીન પ્રતિદીન વધતો જાય છે. જેની ફેર રોપણી માટે જુલાઈ-ઓગષ્ટ માસ વધુ અનુકૂળ આવે છે.

### પિયત અને ખાતર

ગુલાબના પાકમાં પ્રશાલીકાગત પિયત પદ્ધતિ કરતાં ટપક પદ્ધતિથી પિયત તથા ખાતર આપવામાં આવે તો ફુલોના ઉત્પાદનમાં સારો વધારો માલુમ પડેલ છે.

### ટપક પદ્ધતિની વિગત:-

લેટરલ અંતર:-	૩ મીટર
ટપકણીયાની સંખ્યા:-	૩ છોડ વચ્ચે ૧
ટપકણીયા વચ્ચેનું અંતર:-	૧ મીટર
ટપકણીયાની ક્ષમતા:-	૮ લીટર / કલાક

### ટપક પદ્ધતિના ફાયદા

- પાણીની બચત
- ખાતર મજૂરીમાં બચત
- ફુલો વહેલા આવે
- ફુલોના ઉત્પાદનમાં વધારો
- ફુલોની ગુણવત્તામાં વધારો

### પિયત

શિયાળો ૧.૫ થી ૨ કલાક, ઉનાળો ૨ થી ૩ કલાક

### નિંદણ નિયંત્રણ

ગુલાબના પાકની શરૂઆતની અવસ્થામાં છોડ નાના હોય ત્યારે આંતર ખેડ કે ગોડ કરવા અને જરૂરીયાત પ્રમાણે નીદામણ કરવું જોઈએ. વધુમાં નીદામણ નિયંત્રણ માટે પાકના મૂળ વિસ્તારમાં કાળા રંગનું પ્લાસ્ટિક આવરણ (આશરે ૫૦ માઈક્રો) ૫૦% મૂળ વિસ્તારને ઢાકીને કરવાથી આશરે ૮૦ થી ૯૦ ટકા જેટલું નીદામણ નિયંત્રણ કરી શકાય છે અને ફુલોની ગુણવત્તા પણ સૂધરે છે.

### ખાતર

ગુલાબના છોડને તંદુરસ્ત હાલતમાં જાળવવા તેમજ ગુણવત્તા વાળા ફુલો મેળવવા માટે નીચે દર્શાવેલ સમય મુજબ ખાતર આપવું.